



DCY-190801010106 Seat No. _____

B. Sc. (Sem. I) (CBCS) (W.E.F. 2019) Examination

August - 2022

Home Science

General Science-1 (Biology)

(New Course)

Time : 2 Hours]

[Total Marks : 50

- સૂચના :** (1) દરેક પ્રેશનના ગુણ સમાન છે.
(2) દસમાંથી કોઈ પણ પાંચ પ્રેશનોના જવાબ લખો.

- 1 લાક્ષણિક પ્રાણીકોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી કોઈ પણ પાંચ અંગિકાના 10 કાર્ય લખો.
- 2 લાક્ષણિક પુષ્પના વિવિધ ભાગ અને કાર્ય સમજાવો. 10
- 3 અધિશ્છદ પેશીના પ્રકાર, રચના અને કાર્ય સમજાવો. 10
- 4 મૂળના પ્રકાર અને કાર્યો આકૃતિસહ સમજાવો. 10
- 5 બીજની રચના અને પ્રકાર વર્ણવો. 10
- 6 સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રનો ઇતિહાસ વર્ણવો. 10
- 7 કેન્સર વિશે લખો. 10
- 8 સૂક્ષ્મ જીવોની આર્થિક અગત્યતા સમજાવો. 10
- 9 બેક્ટેરિયાથી થતા કોઈ પણ એક રોગ વિશે લખો. 10
- 10 ફૂંગ વિશે નોંધ લખો. 10

ENGLISH VERSION

Instructions : (1) All questions carry equal marks.
(2) Answer any five from ten questions.

- | | | |
|-----------|--|-----------|
| 1 | Draw a neat labeled diagram of typical animal cell and write the functions of any five organelles. | 10 |
| 2 | Explain the structure and function of different parts of typical flower. | 10 |
| 3 | Explain the structure, function and types of epithelial tissue. | 10 |
| 4 | Explain types of roots and their function with diagram. | 10 |
| 5 | Explain the types of seed and its structure. | 10 |
| 6 | Describe the history of microbiology. | 10 |
| 7 | Write about cancer. | 10 |
| 8 | Explain economic importance of micro organisms. | 10 |
| 9 | Write about any one bacterial disease. | 10 |
| 10 | Write about note on fungi. | 10 |